



## Market News

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 20950 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 69825 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 21,006.10 સુધી ઉછળી તો સેન્સેક્સ 69,893.80 સુધી પહોંચ્યો હતો.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.21 ટકા ઘટીને 44,400.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 1.09 ટકા ઘટાડાની સાથે 14,403.95 પર બંધ થયા છે. અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 303.91 અંક એટલે કે 0.44% ની મજબૂતીની સાથે 69825.60 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 68.20 અંક એટલે કે 0.33% ની વધારાની સાથે 20969.40 ના સ્તર પર બંધ થયા છે.

**Bulk Deals:** સોફ્ટબેન્કે ઝોમેટોમાં વેચ્યો હિસ્સો, આ કંપનીએ ખરીદ્યા 1,671.5 કરોડ રૂપિયાના શેર એસવીએફ ગ્રોથ (સિંગાપોર) પીટીઈ લિમિટેડે 8 ડિસેમ્બરે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા ઝોમેટોમાં તેનો હિસ્સો વેચ્યો હતો. બલ્ક ડીલ્સ ડેટા અનુસાર, એસવીએફ ગ્રોથ (સિંગાપોર) એ તેના

વેચ્યા 9.35 કરોડ ઈક્વિટી શેર વેચ્યા છે. આ શેર 120.5 રૂપિયા પ્રતિ શેરના સરેરાશ ભાવ પર વેચાયા હતા. સોદાની કુલ કિંમત 1,127.5 કરોડ રૂપિયા હતી. જાપાનના સોફ્ટ બેન્કના સ્વામિત્વ વાળા વેન્યર કેપિટલ ફંડ એસવીએફ ગ્રોથ (સિંગાપોર) પીટીઈ લિમિટેડે 8 ડિસેમ્બરે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા ઝોમેટોમાં તેનો હિસ્સો વેચ્યો હતો. એક્સચેન્જો દ્વારા પ્રકાશિત પરંતુ ડિલ્સના આંકડાના અનુસાર, એસવીએફ ગ્રોથ (સિંગાપોર)એ વેચ્યા 9.35 કરોડ ઈક્વિટી શેર વેચ્યા છે. આ શેર 120.5 રૂપિયા પ્રતિ શેરના સરેરાશ ભાવ પર વેચ્યા છે. ડીલની કુલ કિંમત 1127.5 કરોડ રૂપિયા રહી છે. તેના પહેલા આ વર્ષ 20 ઓક્ટોબરે તેના 111.2 રૂપિયા પ્રતિ શેરના સરેરાશ ભાવ પર 9.35 કરોડ શેર વેચ્યા હતા. જેથી ઝોમેટોના શેર પર દબાણ જોવા મળ્યો છે. આ સ્ટોક 1.4 ટકા ઘટીને 120 રૂપિયા પર આવ્યો છે. Ant Groupના સ્વામિત્વ વાળા એક અન્ય વિદેશી રોકાણકાર Alipay Singapore Holding Pte Ltd પણ છેલ્લા મહિનામાં 29 નવેમ્બરે તેના પૂરા 29.6 કરોડ શેર અથવા 3.44 ટકા હિસ્સો વેચીને Zomatoથી બહાર નિકળી ગઈ હતી. RBI Monetary Policy: નાણાકીય વર્ષ 2024 ની GDP ગ્રોથ અનુમાન 6.5% થી વધારીને 7% કર્યો

## Results & Corporate Action

Corporate Action	Company	Type & Percentage	Record Date	Ex-Date
<b>Bonus</b>	Sonata	Bonus Ratio 1:1	12-12-2023	12-12-2023
<b>Bonus</b>	Safari Ind	Bonus Ratio 1:1	12-12-2023	12-12-2023
<b>Bonus</b>	Dhyaani Tile	Bonus Ratio 9:5	12-12-2023	12-12-2023
<b>Splits</b>	Sudev Ind	Old FV 10 New FV 5	11-12-2023	11-12-2023
<b>Splits</b>	Teamo Productio	Old FV 10 New FV 1	14-12-2023	14-12-2023
<b>Dividends</b>	BPCL	Interim 210.00	12-12-2023	12-12-2023
<b>Dividends</b>	Rashtriya Chem	Final 37.00	13-12-2023	13-12-2023
<b>Dividends</b>	Hind Zinc	Interim 300.00	14-12-2023	14-12-2023

### Nifty Spot in Last Week:-

ઉપરમાં ૨૧૦૦૬.૧૦ અને નીચામાં ૨૦૫૦૭.૭૫ નો ભાવ જોવા મળ્યો હતો.



NIFTY WEEKLY CHART



BANKNIFTY WEEKLY CHART

### Nifty Spot in Upcoming Week:-

NIFTY નીચામાં ૨૦૭૦૦ નો strong support છે, ઘટાડે ૨૦૬૦૦ ના sl થી ખરીદી કરી શકાય ઉપરમાં ૨૧૩૫૦ થી ૨૧૫૦૦ સુધી નો ભાવ આવી શકે.

### Bank Nifty in Upcoming week:-

BANK NIFTY નીચામાં ૪૬૩૦૦ નો strong support છે, ઘટાડે ૪૬૩૦૦ ના sl થી ખરીદી કરી શકાય ઉપરમાં ૪૮૯૦૦ સુધી નો ભાવ આવી શકે.

## Recommendation for next week

Serial No.	Stock Name Cash segment	Above / Below / Add HOLD	CMP as on 09.12.2023	Trail SL	Buy Stop loss	Sell Stop loss	Target
1	HOVS (BUY)	CMP 61.80	61.80		58		65-70-75
2	LTIM (BUY)	CMP 5708	5708		5540		7000
3	DVL (BUY)	HOLD 354	327		315		400-450

# Commodity Market

**COPPER:** ઘટાડે ૭૧૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય  
૬૯૦ નો SL રાખવા ઉપરમાં ૭૪૫ સુધી નો ભાવ આવી શકે.



**SILVER:** ઘટાડે ૭૦૧૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય  
૬૯૧૦૦ નો SL રાખવા ઉપરમાં ૭૪૦૦૦ સુધી નો ભાવ  
આવી શકે.



**GOLD:-** ઘટાડે ૬૧૩૫૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય  
૬૦૯૦૦ નો SL રાખવા ઉપરમાં ૬૨૨૦૦ સુધી નો ભાવ  
આવી શકે.

## Currency Market (Future Levels)

**USDINR:** ઉછાળે ૮૩.૪૦ ની રેન્જમાં વેચાણ કરી શકાય ૮૩.૬૦ નો s1 રાખવો નીચામાં ૮૨.૩૦ થી ૮૧.૫૦ સુધી નો ભાવ આવી શકે.



**GBPINR:** - ઉછાળે ૧૦૫.૫૦ થી ૧૦૬.૦૦ ની રેન્જમાં ૧૦૬.૫૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૧૦૩.૫૦ સુધી નો ભાવ આવી શકે.



**EURINR:** ઉછાળે ૮૧.૦૦ થી ૮૧.૩૫ ની રેન્જમાં ૮૧.૫૦ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૮૮.૦૦ સુધી નો ભાવ આવી શકે.



**JPYINR:-** ઘટાડે ૫૫.૮૫ થી ૫૫.૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૫૪.૫૦ નો s1 રાખવો ઉપરમાં ૬૦.૦૦ થી ૬૧.૦૦ સુધી નો ભાવ આવી શકે.

Currency FUT LEVEL	DEMAND ZONE LEVEL		CLOSE	SUPPLY ZONE LEVEL	
	D2	D1		S1	S2
<b>USDINR</b>	81.50	82.30	83.38	83.60	85.00
<b>GBPINR</b>	103.00	104.00	104.74	106.20	107.00
<b>EURINR</b>	87.50	88.50	89.84	91.50	92.00
<b>JPYINR</b>	56.50	57.00	57.81	58.50	59.50



## Currency Corner

Premium / Discount (USD/ INR) Based on Forward Rates		RBI reference Rates	
		Currency	Rates
Duration	Premium	USD	183.36
One month Forward	0.08	GBP	105.36
Three month Forward	0.18	Euro	90.94
Six month	0.48	100 Yen	56.27
One year	1.28		

## નીતિ નિર્માતાઓએ ભારતમાં આર્થિક પરિવર્તન કેવી રીતે ચલાવ્યું છે (ભાગ-2)

મિત્રો, સરકારના નિર્ણયની અર્થવ્યવસ્થા પર અસર પડે છે. માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (marcellus@marcellus.in) દ્વારા પ્રસ્તુત એક રસપ્રદ લેખ દ્વારા કેટલીક ઝલક જોવા મળશે.

અલબત્ત, તેઓએ આઝાદી પછી ખૂબ જ વિગતવાર અહેવાલો રજૂ કર્યા છે, અમે તાજેતરની નીતિઓની સંભવિત અસર જોઈશું.

છેલ્લા લેખમાં આપણે સંભવિત અસરના ત્રણ મુદ્દા જોયા છે, આ એકમાં આપણે વધુ બે મુદ્દા જોશું.

1947 પછી, ભારતનું અર્થતંત્ર ચાર અલગ-અલગ યુગોમાંથી પસાર થયું છે. હવે, સમાજવાદ વિલીન થઈ રહ્યો છે અને દેશ વધુને વધુ મુક્ત બજાર અર્થતંત્ર તરીકે કાર્ય કરી રહ્યો છે, અમે પાંચ અલગ દિશાઓ જોઈએ છીએ જેમાં આગામી દાયકામાં ભારતનું અર્થતંત્ર વિકસિત થશે: (1) કેટલીક ઉચ્ચ કાર્યક્ષમ કંપનીઓના હાથમાં નફો ધ્રુવીકરણ કરશે; (2) સારી રીતે શિક્ષિત અને સારી રીતે જોડાયેલા ઉદ્યોગપતિઓના હાથમાં સંપત્તિનું ધ્રુવીકરણ થશે; (3) આર્થિક વૃદ્ધિ કેટલાક અત્યંત વિકસિત રાજ્યોની તરફેણમાં ધ્રુવીકરણ કરશે; (4) અગાઉના બુલેટ્સની ધ્રુવીકરણ અસરોને ઘટાડવા માટે નાણાકીય ટ્રાન્સફરમાં વધારો કરવો પડશે [પ્રદર્શન 1 જુઓ]; અને (5) વિદેશી મૂડી ભારતમાં આવશે

આગળ જતાં ભારતીય અર્થવ્યવસ્થા કેવી રીતે બદલાઈ શકે છે? (પોઇન્ટ 4 અને 5)

જેમ જેમ સમાજવાદ દૂર થતો જાય છે અને ભારતીય અર્થતંત્ર વધુને વધુ નિરંકુશ અખિલ-ભારત મુક્ત બજાર તરફ આગળ વધે છે, વિજેતાઓ અને હારનારાઓ વચ્ચેનું અંતર બહુવિધ પરિમાણો સાથે વિસ્તરતું જાય છે:

### 3. ફિસ્કલ ટ્રાન્સફર વધારવું પડશે

ભારત એક લોકશાહી દેશ છે તે જોતાં, રાજકીય સ્પેક્ટ્રમમાં ચૂંટણી જીતવા માટે પક્ષોએ આ વિશાળ ભૂમિમાં ફેલાયેલા આર્થિક વિકાસના પાયાના કારણે પાછળ રહી ગયેલા મતદારોના બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા પડશે. આ પ્રદર્શન 1 માં જોઈ શકાય છે (જે દર્શાવે છે કે GDP ના % તરીકે સરકારનો ખર્ચ કેવી રીતે સતત વધ્યો છે) અને પ્રદર્શન 5 માં (જે દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં શિક્ષણ, ખોરાક, બળતણ અને ખાતરો પર સરકારનો ખર્ચ કેવી રીતે વધ્યો છે).

**Exhibit 5: Indian government's expenditure as a % of GDP in four eras shows definite policy focus**

Eras in the Indian Economy	Government Capex as a % of GDP	Government Spending on Healthcare as a % of GDP	Government Spending on Education as a % of GDP	Government Spending on Food, Fertilizer, and Petroleum Subsidies as a % of GDP
Era 1: 1947-1979	4.9% <sup>''</sup>	NA	NA	NA
Era 2: 1980-1990	6.7%	NA	NA	1.1% <sup>'</sup>
Era 3: 1991-2013	3.8%	3.7% <sub>-</sub>	3.6% <sup>'''</sup>	1.5%
Era 4: 2014-2023	3.9%	3.3% <sub>-</sub>	4.2% <sup>'''</sup>	1.7% <sup>'</sup>

*Source: Marcellus Investment Managers, Union Budget, EPW Research Foundation, World Bank, Macrotrends; '' - reliable and continuous data available only after 1971 and therefore start year considered is 1971 - government capex data taken from budget documents and for pre 2008-09 divided by current GDP; \_ - data starts from 2001 and ends by 2021; data starts in 1998 and ends in 2020 with gaps in the following years - 2002, 2003, 2008, 2009; ''' - data starts in 1997 with gaps in the following years - 2001, 2002, 2007, 2008, 2016, 2018, and 2019; ' - data starts in 1979 and actual figures used everywhere except for the years 2021-22 and 2022-23 where revised and budgetary estimates are used respectively*



રાજસ્થાન, એમપી, છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યોમાં હાલમાં ચાલી રહેલા વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પણ નાણાં ખર્ચવાની ચૂંટણીની મજબૂરી જોઈ શકાય છે. એવોર્ડ વિજેતા પત્રકાર અને લેખક તરીકે શંકર ઐયર લખે છે:

“તે ઉપદેશક છે કે મતદાન બંધાયેલા રાજ્યોમાં હરીફાઈ વિચારો અને વિચારધારા વિશે ઓછી અને યોજનાઓની સ્પર્ધા વધુ છે. એક પછી એક રાજ્યમાં, રાજકીય પક્ષોએ અસંતોષને કાબૂમાં રાખવા માટે યોજનાઓ તૈયાર કરી છે.

“...ભૂતકાળથી વિપરીત યોજનાઓ જાતિ, વર્ગ અને લિંગના માપદંડોના આધારે મત મેળવવા માટે લક્ષિત છે. મહિલા મતદારો-જેઓ 161.4 મિલિયન મતદારોમાંથી 78 મિલિયન છે- મધ્યપ્રદેશમાં શિવરાજ ચૌહાણ શાસને લાડલી બેહના યોજના હેઠળ રોકડ ટ્રાન્સફરને 1250 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા અને તેને વધારીને 3000 રૂપિયા પ્રતિ માસ કરવાનું વચન આપ્યું છે.

“...ત્યાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરનું વચન છે અને પછી ટોપ-અપ વ્યૂહરચના છે જ્યાં રાજ્યો રાજ્ય કિટીમાંથી વધારાની ફાળવણી સાથે કેન્દ્ર દ્વારા આપવામાં આવતી ચૂકવણી/સબસિડીમાં ઉમેરો કરે છે.

“...આધાર આધારિત DBT-ભારતની ઉપલબ્ધતા દ્વારા સબસિડી માટે રોકડ લાભ ટ્રાન્સફર અને ટોપ અપ સક્ષમ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકારોએ NPCI ગ્રીડ પર અસંખ્ય ટ્રાન્સફર માટે 7500 થી વધુ વપરાશકર્તા કોડ નોંધ્યા છે. ખાતરી માટે ત્યાં કોઈ મફત લંચ નથી પરંતુ રાજકીય પક્ષો વચનોના ખર્ચની રૂપરેખા આપવા અથવા વધારાના ખર્ચને કેવી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવશે તેની રૂપરેખા આપવા માટે બંધાયેલા નથી. ...” (સ્ત્રોત:

<https://www.bqprime.com/opinion/the-politics-of-economics-signals-from-the-election-campaign>)

## 5. વિદેશી મૂડીમાં પૂર આવશે

વિદેશી રોકાણકારોએ ચીનના શેરબજારમાં આશરે \$3.5 ટ્રિલિયનનું રોકાણ કર્યું છે. આ બજારે છેલ્લા એક દાયકામાં (US\$માં) 4.7% (સ્રોત: બ્લૂમબર્ગ)ના કુલ વળતર CAGRનું ઉત્પાદન કર્યું છે. તેનાથી વિપરીત, વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં \$0.6 ટ્રિલિયનનું રોકાણ કર્યું છે જેણે પાછલા એક દાયકામાં (US\$માં) 12.6% (સ્રોત: બ્લૂમબર્ગ) નું કુલ વળતર CAGR આપ્યું છે એટલે કે, ચીની બજાર દ્વારા જનરેટ કરાયેલા વળતર કરતાં 2x વધુ . જો તમે આ ડેટાને 20 વર્ષ અથવા 30 વર્ષ સુધી લંબાવો છો, તો નિષ્કર્ષ એ જ રહે છે. વિશ્વનું એકમાત્ર મોટું શેરબજાર જે છેલ્લાં 30 વર્ષોમાં ભારત સાથે ટકી રહેવા સક્ષમ છે તે યુએસએ છે. ચીનની અર્થવ્યવસ્થા અને ભૌગોલિક રાજનીતિની આસપાસ વધતી ચિંતાઓ સાથે, પશ્ચિમી ફાળવણીકારોએ મૂડી રોકાણ કરવા માટે વૈકલ્પિક બજાર તરીકે ભારત તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

એફડીઆઈના મોરચે પણ આવી જ વાર્તા જોવા મળે તેવી શક્યતા છે. છેલ્લા એક દાયકામાં, વિદેશી રોકાણકારોએ સરેરાશ આશરે US\$ 120 બિલિયન p.a. વિ. માત્ર US\$ 12 બિલિયન p.a. ભારતમાં. ચીન અને અમેરિકન સરકારો વચ્ચે હવે અણબનાવ છે, ચીનમાં આ એફડીઆઈનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. અમેરિકા ભારતનો ઉપયોગ ચીનના કાઉન્ટરવેઈટ તરીકે કરવા ઈચ્છુક હોવાથી, આમાંથી કેટલાક પ્રવાહ ભારતમાં આવે તેવી શક્યતા છે.

ભારતને આની જરૂર છે - FPI અને FDI બંને - તેની ચાલુ ખાતાની ખાધને ફાઇનાન્સ કરવા માટે પ્રવાહની જરૂર છે જે GDP ના 2-3% (\$60-100 bn p.a.) વચ્ચે ચાલે છે કારણ કે ભારતની સ્થાનિક નાણાકીય બચત 50 વર્ષની નીચી સપાટીએ છે.

પૂર્વ એશિયાના અર્થતંત્રોથી વિપરીત (જે ઓછા વેતનવાળા કામદારો દ્વારા બનાવેલ માલની નિકાસ દ્વારા વિકસ્યું છે), ભારતની વૃદ્ધિને મોટી સર્વિસ અર્થતંત્ર (જીડીપીના 55%) અને જ્ઞાન સઘન સેવાઓની નિકાસ (IT સેવાઓની નિકાસ \$250 bn p.a.) દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. ) અને ઉત્પાદનો (ફાર્મા નિકાસ \$25 બિલિયન p.a. છે). વિદેશમાં રહેતા ભારતીયો તરફથી રેમિટન્સ \$100 બિલિયનથી વધુનો પ્રવાહ લાવે છે. તેથી, ભારતના સુશિક્ષિત મધ્યમ વર્ગની બૌદ્ધિક હોર્સપાવરને કારણે દર વર્ષે લગભગ \$400 બિલિયન (GDPના 9%) ભારતમાં આવે છે, INR એ વધુ પડતું ચલણ છે. આનાથી ભારત માટે કપડાં, પગરખાં અને રમતગમતના સામાન

જેવા લો-એન્ડ ઉત્પાદિત માલનો નિકાસકાર બનવું લગભગ અશક્ય બની જાય છે. ઓવરવેલ્યુડ INR ભારતીયો માટે આયાતી ચીજવસ્તુઓ (ખાસ કરીને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, વિદેશી રજાઓ અને વિદેશમાં શિક્ષણ) સાપેક્ષ સસ્તી બનાવે છે આમ ચાલુ ખાતાની ખાધ અને નીચા સ્થાનિક નાણાકીય બચત દરને બળ આપે છે (જુઓ <https://marcellus.in/blogs/midnight-approaches> -ભારત માટે-રિટેલ-ધિરાણ-તેજી/).

આ વર્તુળને ચોરસ કરવા માટે, ભારતે વિદેશી મૂડીને આકર્ષવાનું ચાલુ રાખવાની જરૂર છે. વિદેશી રોકાણકારોને ચીનમાં જે નિરાશાજનક અનુભવ થયો છે તે જોતાં, જો તેઓ છેલ્લા દાયકામાં ચીનમાં કરેલા રોકાણના 10% પણ ભારત તરફ વળે તો ભારતીય અર્થતંત્ર પર તેની અસર પરિવર્તનકારી હશે.

### **HEAD OFFICE**

B/230-231, International Trade Center, Majura Gate, Ring Road, Surat-2. (Guj.) India Ph: 0261-40 60 750, 246 27 90 Fax: 0261-246 27 91 [www.markethubonline.com](http://www.markethubonline.com) E-Mail: [info@markethubonline.com](mailto:info@markethubonline.com)

**IA SEBI REGISTRATION NO.:INA000005333**

**Disclaimer:**

We do not represent that information provided by us is accurate or complete and it should not be relied upon as such. The advice provided here is just for knowledge purpose only. The user assumes the entire risk of any use made or not made of this information. INVESTMENT IN EQUITY, MUTUAL FUND, EQUITY, CURRENCY & COMMODITY DERIVATIVES IS SUBJECT TO RISK. WE ARE DISTRIBUTOR OF MUTUAL FUND Client should read the Risk Disclosure Document (RDD) & Do's and Don'ts issued by SEBI & relevant exchanges before investing